

**Deep Energy  
Resources Limited**

12<sup>th</sup> July, 2023

**To,**  
**BSE Limited**  
Corporate Relations Department  
2<sup>nd</sup> Floor, P.J. Towers,  
Dalal Street,  
Mumbai-400 001.

**To,**  
**National Stock Exchange of India Limited**  
Corporate Relations Department  
Exchange Plaza, Plot No. C-1, Block-G,  
Bandra Kurla Complex, Bandra (East),  
Mumbai – 400 051.

**Scrip Code : 532760**

**Symbol: DEEPENR**

**Sub: Disclosure under Regulation 30 read with Part A of Schedule III and Regulation 47 of Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 - Newspaper Advertisement.**


Dear Sir/Madam

In terms of Regulation 30 read with Part A of Schedule III and Regulation 47 of Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please find enclosed herewith the copies of Newspaper Advertisements published in the Business Standard – English and Jai Hind – Gujarati on today i.e. 12<sup>th</sup> July, 2023 in respect of notice to the shareholders for proposed transfer of Equity Shares of the Company to Investor Education and Protection Fund Authority (IEPF Authority).

You are requested to take the same on your record.

Yours Faithfully,

For, Deep Energy Resources Limited

  
Divyeshkumar Senjaliya  
Company Secretary and Compliance officer  
M. No: A60456



Encl: As above

**DEEP ENERGY RESOURCES LIMITED**

(Formerly known as Deep Industries Limited)

Regd. Office Address : 12A & 14, Abhishree Corporate Park, Ambli-Bopal Road, Ambli, Ahmedabad-380 058.

Tel. : 02717-298510 Fax : +91 2717 298520 E-mail : info@deepenergy.ooo Website : www.deepenergy.ooo

CIN : L63090GJ1991PLC014833



# ITC CMD's salary jumps 53% to ₹16.31 cr

**PRESS TRUST OF INDIA**  
11 July

The board of ITC Limited has recommended the reappointment of Sanjiv Puri (pictured) as the chairman & managing director for a second term of five years. His total remuneration was also increased 53.08 per cent to ₹16.31 crore for financial year 2022-23.

Puri drew a basic salary of ₹2.88 crore, perquisites and other benefits of ₹57 lakh and a performance bonus/ long-term incentives/ commission of ₹12.86 crore from ITC for 2022-23.

A year ago, Puri's total remuneration was ₹10.66 crore, which included a basic salary of ₹2.64 crore, perquisites and other benefits of ₹49.63 lakh. However, his performance bonus/ commission was ₹7.52 crore only in FY22. The resolution seeking his reappointment as chairman and managing director of the diversified conglomerate will be put to vote at the company's annual general meeting to be held on August 11, 2023, according to a notice sent to the shareholders on Tuesday. The company under Puri drove the 'ITC Next' strategy in the last four years encompassing digital acceleration, officials said.

# Consumer spend on firm's FMCG biz grew 21% to ₹29K cr in FY23

**PRESS TRUST OF INDIA**  
11 July

ITC's fast-moving consumer goods (FMCG) business recorded a 21 per cent rise in annual consumer spend to nearly ₹29,000 crore in the financial year ended March 31, 2023 (FY23), according to the latest annual report of the diversified conglomerate.

ITC operates in the FMCG space with 25 home-grown brands — food brands such as Aashirvaad, Bingo, Sunfeast, and YiPee, while in personal

care, it has brands such as Fiama, Vivel, Savlon, etc.

The company measures annual consumer spend as the sum total of what the consumer spends on buying the goods of the company. It is the net sales turnover of the brands along with channel margins and taxes. The annual consumer spend of nearly ₹29,000 crore is around 21 per cent higher than the that in

**The firm said it was pursuing 'value accretive' buys, JVs and collaboration opportunities for accelerating growth and value creation**

2021-22. In the last annual report, ITC said its FMCG business had an annual consumer spend of over ₹24,000 crore.

In terms of distribution reach, ITC said in FY23 its products reached 230 million households, up from over 200 million households in FY22.

In FY23, gross revenue from the sale of pro-

ducts and services stood at ₹69,480.89 crore, in which its cigarette business contributed ₹28,206.83 crore and FMCG business was at ₹19,122.50 crore.

Its ITC e-Store, a D2C platform, is now operational in 24,000+ PIN codes and continues to receive excellent consumer response.

ITC said it was well poised to address value-added adjacencies and categories of the future by leveraging the 25 powerful mother brands it had established over the years.

# Fired staffer of tech firm kills MD, CEO with sword

The managing director (MD) and the chief executive officer (CEO) of a Bengaluru-based company were allegedly murdered by a former employee, according to a *Business Today* report. The accused, identified as Felix, was fired from the firm a few months ago, and he killed his

former bosses with a sword. Felix had established his own company, which competed with his former employers, an *Indian Express* report said. The deceased have been identified as Phanindra Subramanya, MD, and Vinu Kumar, CEO, respectively.

AGENCIES

**NabFID** National Bank for Financing Infrastructure and Development  
www.nabfid.org

**CORRIGENDUM**  
Advertisement dated 27<sup>th</sup> June 2023

The eligibility criteria of minimum experience for various positions in the grades of Executive Vice President (EVP) & Vice President (VP) advertised on 27<sup>th</sup> June 2023, have been modified as per details notified on our Bank's website. Interested candidates are advised to visit the Bank's website <https://nabfid.org/careers/> to apply for the positions. All other eligibility criteria as prescribed under advertisement & notification dated 27.06.2023 on the Bank's website remain unchanged. The applicants who have already submitted their application need not apply again and their applications will also be considered as per the modified criteria. The last date for receipt of application has been extended to 25<sup>th</sup> July 2023 06:00pm IST. Mumbai: 11-July-2023 Executive Vice President (HR)

**SECURITE**  
Cybersecurity Delivered

Rakhe Desh Ke Har Business Ko Cyber Surakshit  
**Secure your tomorrow, today.**

- Future-ready solutions for enterprises of any scale & size
- Protection against ransomware attacks and data breaches
- Backed by international patents and certifications

Proven-track record of protecting critical infrastructure of the country.

Quick Heal Group | Phone: 1800-212-7377 | info@seqrte.com | www.seqrte.com

**Bank of India proudly announces the inauguration of International Banking Unit at GIFT City, Gujarat.**

Bank of India is enriching India's financial landscape by bringing 77 years of expertise in International Finance Centres to GIFT City, Gujarat. The new branch will offer cutting-edge, world-class financial products & services to fulfil various banking requirements of both domestic and international clients.

At present, Bank of India has 21 Foreign branches across the World.

Toll Free No.: 1800 220 229 / 1800 103 1906 | Visit : www.bankofindia.co.in | Follow us on [Social Media Icons]

**Business Standard**

**EV DIALOGUES**  
in association with

**CHARGE ZONE** **BILLIONE**

**HIGHWAY TO GREEN GROWTH: ROLE OF EVs**

July 18 | Taj Mahal, New Delhi

**Chief Guest**  
**Nitin Gadkari**  
Union Minister for Road Transport & Highways

In a fireside chat with **Nivedita Mookerji**  
Executive Editor, Business Standard

Session 1: How to make EVs mainstream by 2030?  
Session 2: Becoming *atmanirbhar* in EVs

Participation by invitation only  
For invites, register at [bit.ly/bs-ev](http://bit.ly/bs-ev) or write to [lalit.saini@bsmail.in](mailto:lalit.saini@bsmail.in)

Co-sponsor: **LF FINANCIAL SERVICES**, **FWI**, **MEV** SOCIETY OF MANUFACTURERS OF ELECTRIC VEHICLES, **FRAMES DIGITAL**

**Business Standard**  
Insight Out

business.standard | bsindia | business-standard.com

**pnb** **पंजाब नैशनल बैंक** **punjab national bank**

Zonal SA STRA: Ahmedabad, 4th Floor, Chanakya Building, Nr. Dinesh Hall, Opp. Ashram Road, Ahmedabad-380009. Ph.: 079-47010262. E-mail: [zs8336@pnb.co.in](mailto:zs8336@pnb.co.in)

APPENDIX IV [Rule 8(1) of Security Interest (Enforcement) Rules, 2002]

**POSSESSION NOTICE**  
(For Immovable Property)

Whereas, The undersigned being the Authorized Officers of Punjab National Bank, Zonal SA STRA, Ahmedabad, 4TH Floor, Chanakya Building, Near Dinesh Hall, Off Ashram Road, Ahmedabad-380009, on behalf of consortium members acting as lead Bank, under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002 and in exercise of powers conferred under section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002, issued on as mention below by Member banks of the consortium calling upon the Borrower Shrenik Limited, Shrenik Sudhir Vimawala (Director/Guarantor/Mortgagor), Rishit Shrenikbhai Vimawala (Director /Guarantor/Mortgagor), Suresh Amulakbhai Shah (Guarantor/Mortgagor), Amit Harivadan Parikh (Guarantor/Mortgagor), Ratanlal H Bothra (Guarantor/Mortgagor), Kaivan Vimawala (Director /Guarantor) and Himaben Vimawala (Guarantor) to repay the amount as mentioned in the notice payable with future interest and expenses until payment in full, within 60 days from the date of notice/ date of receipt of the said notice as mention below:-

| S. No | Bank's Name          | Date of facility | Nature of facility            | Limit Amount  | Amount outstanding and Recorded interest as mentioned in 13(2) Notice   |
|-------|----------------------|------------------|-------------------------------|---|---|
| 1.    | Punjab National Bank | 29 April 2022    | CC Limit<br>FITL Loan<br>CECF | 60,00,00,000.00<br>3,36,69,087.00<br>6,00,00,000.00 | Outstanding<br>Rs. 77,66,29,268.73 as on 28.04.2022 + future interest and other service charges<br>Total<br>69,36,69,087.00 |
| 2.    | State Bank of India  | 04 May 2022      | CC Limit                      | 35,75,00,000.00                                     | Outstanding<br>Rs. 40,80,75,703.12 as on 30.04.2022 plus future interest and other service charges                          |

The Borrower having failed to repay the entire amount, notice is hereby given to the Borrower/Mortgagor and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him under section 13(4) of the said Act read with rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002 rule on this 07th day of July, 2023.

The Borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of Punjab National Bank and State Bank of India which are lenders to Shrenik Limited for Bank wise amount as mentioned here under as on 30.06.2023 and payable with future interest (w.e.f.01.07.2023) and expenses until payment in full.

| S. No | Bank's Name          | Date of facility | Nature of facility            | Limit Amount  | Amount outstanding and Recorded interest in Rs. till 30.06.2023 |
|-------|----------------------|------------------|-------------------------------|---|---|
| 1.    | Punjab National Bank | 29 April 2022    | CC Limit<br>FITL Loan<br>CECF | 60,00,00,000.00<br>3,36,69,087.00<br>6,00,00,000.00 | Rs. 89,32,92,690.81   |
| 2.    | State Bank of India  | 04 May 2022      | CC Limit                      | 35,75,00,000.00                                     | Rs. 44,93,92,721.74   |

Amount recovered after issuance of 13(2) till 30.06.2023:  
Punjab National Bank: Rs. 6,42,67,982.38 (Rupees Six Crore Forty Two Lakh Sixty Seven Thousand Nine Hundred Eighty Two and Paise Thirty Eight Only)  
State Bank of India: Rs. 4,10,27,873.42 (Rupees Four Crore Ten Lakh Twenty Seven Thousand Eight Hundred Seventy Three and Paise Forty Two Only)  
The Borrower's/Mortgagor's/Guarantor's attention is invited to provision of Sub-section (8) of Section 13 of the Act in respect of time available to redeem the secured assets.

**SECURITY**

1. Office No 803, Eighth Floor, in the scheme known as "Elite", together with undivided proportionate share in land, lying at Mouje Sola, Taluka Ghatlodia, District, Ahmedabad, Gujarat. 686.70 Sq. Fts. (Built up Area)  
Bounded as under: - East: -Marginal Space thereafter Parking, West:-Office No. 802, North:-Internal Road, South:-Office No. 804  
Property Owner: Shrenikbhai Sudhirbhai Vimawala  
Date of Symbolic Possession: 25.01.2023

Date : 07/07/2023 (Abhinav Singh Rathore)  
Place : Ahmedabad Authorised Officer, Punjab National Bank

**DEEP ENERGY RESOURCES LIMITED**  
CIN: L63090GJ1991PLC014833

Regd Office: 12A & 14, Abhisree Corporate Park, Ambli Bopal Road, Ambli, Ahmedabad 380058 Ph. 02717-298510 Fax: 02717-298520  
E-mail: [info@deepenergy.org](mailto:info@deepenergy.org) Website: [www.deepenergy.org](http://www.deepenergy.org)

**NOTICE**  
**Transfer of Equity Shares to Investor Education and Protection Fund Authority (IEPF Authority)**

This notice is hereby given to the shareholders of the Company pursuant to the provisions of Section 124(6) of the Companies Act, 2013 ("the Act") read with the Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016 and subsequent amendments thereto ("IEPF Rules") In terms of the provisions of Section 124(6) of the Act read with the IEPF Rules, the shares in respect of which dividend has not been encashed or claimed for 7 (seven) consecutive years or more are liable to be transferred by the Company to the Investor Education and Protection Fund (IEPF).

Adhering to the various requirements set out in the IEPF Rules, the Company has already sent notices to those shareholders at their registered address, who have not claimed their dividend for 7 (seven) consecutive years or more, to claim the said unclaimed dividend(s) on or before by 11/10/2023, to avoid transfer of their shares to the Demat Account of the IEPF Authority.

In terms of Rule 6 of the IEPF Rules, a statement containing details of the name(s) of the shareholder(s) and their Folio No./ DP ID-Client ID whose shares are liable to be transferred to the Demat Account of the IEPF Authority is available on the website of the Company ([www.deepenergy.org](http://www.deepenergy.org)) for information and necessary action by the shareholder(s).

In case no valid claim in respect of such equity shares is received from the concerned shareholders on or before 11/10/2023, the said equity shares shall be transferred to the Demat Account of the IEPF Authority as per the procedure stipulated under the IEPF Rules. In this connection, please note that -

- For equity shares held in electronic mode, the Company shall inform the Depositories to execute the Corporate Action and debit the shares lying in the demat account of the shareholder(s) and transfer such shares to the Demat Account of the IEPF Authority in accordance with the procedure set out in the IEPF Rules without any further notice.
- For equity shares held in physical form, new share certificate(s) in lieu of the original share certificate(s) will be issued and subsequently transferred to the demat account of the IEPF Authority in accordance with the procedure as set out in the IEPF Rules without any further notice. Further, upon issue of such new share certificate(s) the original share certificate(s) which stand registered in the name of shareholder(s) will be deemed cancelled and non-negotiable.

For claiming unclaimed dividend, the concerned shareholders may contact to the Company's Registrar & Transfer Agent at M/s Link Intime India Pvt. Ltd., 5<sup>th</sup> Floor, 506 to 508, Amarnath Business Centre-1 (ABC-1), Beside Gala Business Centre, Nr St. Xavier's College Corner, Off C G Road, Ellisbridge Ahmedabad-380006, Tel No.: 079-26465179, e-mail: [iepf.shares@linkintime.co.in](mailto:iepf.shares@linkintime.co.in).

The concerned shareholders may note that, upon such transfer they can claim their shares along with dividend(s) from the IEPF Authority by making an online application in Form IEPF-5 available on website of IEPF Authority ([www.iepf.gov.in](http://www.iepf.gov.in)) along with fees specified by the Authority from time to time in consultation with the Central Government after obtaining the letter of entitlement from the Company in terms of Office Memorandum dated 20<sup>th</sup> July, 2022 issued by the IEPF Authority. It may be noted that no claim shall lie against the Company in respect of unclaimed dividend(s) and shares transferred to IEPF pursuant to the IEPF Rules.

Special Window Facility for Senior-Citizens of age 75 Years & above  
Investor Education and Protection Fund Authority as a part of Azadi Ka Amrit Mahotsav (AKAM) has launched a special window facility for senior citizens of age 75 years & above. As a part of this facility, the claim filed by these claimants shall be auto-prioritized in MCA 21 system after receipt of e-verification report from the companies.

For facilitation of these claimants, a dedicated telephone number 011-23441727 & email id [seniorcitizen.iepf@mca.gov.in](mailto:seniorcitizen.iepf@mca.gov.in) has been established.

Sd/-  
Divyeshkumar Senjaluya  
Company Secretary and Compliance Officer

Place : Ahmedabad Date : 11-07-2023



આંતરરાષ્ટ્રીય રિસર્ચ એજન્સી દ્વારા ભારતની વધતી માનવ શક્તિ પરથી રિપોર્ટ તૈયાર કરાયો

૨૦૭૫ સુધીમાં ભારતનું અર્થતંત્ર અમેરિકાને પણ પછાડી દેશે: ગોલ્ડમેન સૈક્સ

નવી દિલ્હી તા.૧૧ આજે વિશ્વ વસ્તી દિને ગોલ્ડમેન છે તે તેની સાથે ઉત્પાદકતા પણ વધારશે અને...

દુનિયામાં રાત્રે ફેસબુક, વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ થયા ઠપ્પ: યુઝર્સ પરેશાન

ફેસબુક ઈન્સ્ટાગ્રામ અને વોટ્સ એપ પૂરી દુનિયામાં ડાઉન હોવાની ખબર છે. ડાઉન રિસ્કટરે પણ તેની પુષ્ટિ કરી છે. ઈન્સ્ટાગ્રામને વર્ષને ૧૩૦૦૦, ફેસબુકને વર્ષને ૫૪૦૦ અને વોટ્સએપને વર્ષને ૧૮૭૦ યુઝર્સ આ મામલે ફરિયાદ કરી છે.

જોકે ભારત પાકાત રહ્યું: ત્રણેય સાઈટ બે કલાક ઠપ્પ રહી: મોટા આઉટિજ પર મેટાનો ઠગુ સુધી ખુલાસો નહીં

કે વગલગ બે કલાક સુધી આ ત્રણેય સાઈટ્સ ઠપ્પ રહી હતી. ફેસબુક ડાઉન થયા બાદ મેટાના એડ મેનેજરમાં મુશ્કેલી આવી રહી હતી. આ દરમિયાન યુઝર્સ પોતાના ફેસબુક પેજ પર એડ નહોતા લગાવી શકતા. ભારતમાં ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપ સારી રીતે કામ કરી રહ્યા છે જો કે અમેરિકા સહિત અનેક દેશોના યુઝર્સને મુશ્કેલી પેદા થઈ રહી છે.

Torrent Power logo and text: ટોરન્ટ પાવર લિમિટેડ નોટીસ

Deep Energy logo and text: દિપ એનર્જી રીસોર્સીસ લિમિટેડ

કંપની ના ઇક્વિટી શેરોનું ઇન્વેસ્ટર એક્સચેન્જ સેલ પ્રોટેક્શન ફંડ ઓથોરિટી માં ટ્રાન્સફર (IEPF ઓથોરિટી) આ નોટિસ આથી કંપનીના શેરહોલ્ડરોને કંપની અધિનિયમ, ૨૦૧૩ ("અધિનિયમ") ની કલમ ૧૨૪(દ) ની જોગવાઈઓ અને ઈન્વેસ્ટર એક્સચેન્જ સેલ પ્રોટેક્શન ફંડ ઓથોરિટી (એકાઉન્ટિંગ, ઓડિટ, ટ્રાન્સફર અને રિફંડ) રૂલ્સ, ૨૦૧૬ અને તેના પછીના સુધારા ("IEPF નિયમો") અનુસાર આપવામાં આવી રહી છે.

ARIES AGRO LIMITED table with columns: S.No, Generic Name, Brand Name, Contents of the Products

જાહેર નોટીસ શ્રી એસ.જી.વાપડા (GAS) સહાયકીયતલ મેટ્રોપોલિટન, દસકોઈ માંત, અમદાવાદની કોર્ટ અરજદાર :- પરમાર ઈશ્વરભાઈ ખાનાભાઈ

ELECON ENGINEERING COMPANY LIMITED logo and contact info

Table with columns: Sr. No., Particulars, Standalone (Quarter Ended, Year Ended), Consolidated (Quarter Ended, Year Ended)

Notes: 1. The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.

EIMCO ELECON logo and text: EIMCO ELECON (INDIA) LTD. CIN : L29199GJ1974PLC002574

Table with columns: Sr. No., Particulars, Standalone (Quarter Ended, Year Ended), Consolidated (Quarter Ended, Year Ended)

Notes: 1. The above is an extract of the detailed format of Financial Results for the quarter ended on 30th June, 2023 filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.